

# PARLE MAHOTSAV

Organiser - **ADV. PARAG ALAVANI**, MLA, President - Vile Parle Cultural Centre  
2, Amber Palace, Chittaranjan Road, Vile Parle (East), Mumbai 400 057.  
Tel.: 26136513, 26177125 • Website : [www.parlemahotsav.com](http://www.parlemahotsav.com)



## પાર્લે મહોત્સવે 18 વર્ષમાં ભવ્ય પરિવાર નિર્માણ કર્યો છે: સાંસદ રાવસાહેબ દાનવે પાટીલ

મુંબઈ, તા. 23 ડિસેમ્બર, 2017: ગયાં 18 વર્ષ પાર્લે મહોત્સવ ફૂલીફાલી રહ્યો હોઈ પહેલા વર્ષથી મહોત્સવમાં ભાગ લેનારા સ્પર્ધકો, પંચ- પરીક્ષક અને કાર્યકરો 18મા વર્ષમાં પણ જોડાયેલા હોઈ પાર્લે મહોત્સવ એક મોટો પરિવાર બની ચૂક્યો છે, એમ ભાજપ પ્રદેશાધ્યક્ષ સાંસદ રાવસાહેબ દાનવે પાટીલે જણાવ્યું હતું.

મેં પોતે સ્પર્ધક, પ્રેક્ષકને નાતે અનેક સ્પર્ધાઓનો આનંદ લીધો હોવાથી આ ભવ્ય મહોત્સવનું ઉદઘાટન કરવા મળતાં વિશેષ ખુશી થઈ રહી છે. પાર્લે મહોત્સવ જેવા મોટા ઉપક્રમ સતત 18મા વર્ષે ચાલુ રાખીને એક પરિવાર ઊભો કરવા બદલ વિધાનસભ્ય પરાગ અળવણીને અભિનંદન આપવા રહ્યા. સ્પર્ધકો જો હારે તો પણ આશા ગુમાવ્યા વિના આગામી સ્પર્ધા માટે તૈયારી કરવાથી સફળતા નક્કી મળશે, એવી સલાહ પણ આ પ્રસંગે તેમણે હાજર સૌને આપી હતી.

યુવાનો માટે પાર્લે મહોત્સવ તેમના કળાગુણોને નિખારતું એક મહત્ત્વપૂર્ણ મંચ હોઈ તેનો લાભ બધા યુવાનોએ લેવો જોઈએ એમ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ સાંસદ પૂનમ મહાજને આ સમયે જણાવ્યું હતું. મહોત્સવ સફળ કરવા બદલ યુવા કાર્યકરોને તેમણે અભિનંદન આપ્યા હતા.

મહોત્સવના પહેલા દિવસે વોલીબોલ, કબડ્ડી, બોક્સ ક્રિકેટ અને પહેલી વાર સેફ ડ્રાઈવિંગ સ્પર્ધામાં આશરે 3500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને પહેલા દિવસે કબડ્ડીમાં આશરે 78 મેચ, બોક્સ ક્રિકેટની 30 મેચ અને વોલીબોલની 40 મેચ રમાઈ હતી. વોલીબોલ સ્કૂલ જૂથની સ્પર્ધામાં છોકરાઓની 12 અને છોકરીઓની 12 ટીમે ભાગ લીધો હતો. આ ટીમોને પ્રોત્સાહન આપવા માટે વાલીઓ અને મિત્રજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ વખતે મહોત્સવમાં કબડ્ડી સ્પર્ધા પશ્ચિમ ઉપનગર જિલ્લા કબડ્ડી એસોસિયેશન બ જૂથ જીતી હતી. વામન મંગેળ દુભાષી મેદાનમાં રમતગમત રસિકોએ ભારે ભીડ જમાવી હતી.